

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૦/૫/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૧૨૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૫ કેસ કરી ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૫૧૦ લીટર દેશી દારૂ, ૧૧૦ બોટલ ઇંગ્લીશ દારૂ, ૩૫ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૧૦૧ બિયર ટીન, ૧ રિક્ષા, ૩ મોટર સાયકલ, ૨ સ્કૂટર અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૫ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૪,૮૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૨૭/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૭૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૧૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૧૨૮/૧૭

શહેરકોટડા: જયકુમાર દિનાનાથ પ્રજાપતિ (રહે. પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ-૨ કુષ્માનગર નવા નરોડા) એ તા.૨૮/૫/૧૭ નારોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે એકાદ વર્ષ પહેલા આરોપી ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ અને પુજાબહેન સિંધી એ ભેગા મળી અમદુપુરા સફલ-૪ કોમ્પ્લેક્ષમાં હની એપ્રીયલ્સ એ/૩૩૧ ત્રીજા માળે જયકુમાર પાસેથી એમ્પ્રોડરીનુ કામ કરાવી રૂપિયા ૪,૪૦,૪૪૦/- નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.એસ.ડામોર ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૧૨૯/૧૭

વટવા: મંજુલાબહેન હરેશભાઈ ચૌહાણ (રહે.પ્રગતીનગર મોતીપુરા ચોકડી પાસે જયેશમીલની સામે શાહવાડી નારોલ વટવા) એ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૫/૧૭ રાતના ૧૦/૦૦ થી તા.૨૯/૫/૧૭ સવારના ૬/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનુ તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોન નંગ-૨ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૩૯,૮૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે એસ પટેલ ચલાવે છે.

ટ્રેઈનની અડફેટે મૃત્યુ:

સમાચાર યાદી નં.૧૧૩૦/૧૭

**ખોખરા:** કાળુભાઈ દેવસીભાઈ મોલાડીયા (ઉ.વ.૫૦) (રહે.તંબોળીની ચાલી ગોરના કુવા પાસે ખોખરા) તા.૨૮/૫/૧૭ સાંજના ૭/૩૦ વાગ્યાના સુમારે દક્ષીણી અંડર બ્રીજ પાસે રેલ્વેના પાટા ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટ્રેઈનની અડફેટે આવી જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજયું હતુમા અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી ઉકાભાઈ કાનાભાઈ ચલાવે છે.

અકસ્માતે મૃત્યુ:

સમાચાર યાદી નં.૧૧૩૧/૧૭

**નરોડા:** નરોડા જીઆઇડીસી સિધ્ધેશ્વરી એસ્ટેટ ગુજરાત મેટલ નામની કંપનીમાં કામ કરતા અને ત્યાજ રહેતા નરેંદ્ર સિંગ રામનદનસિંગ રાજપુત(ઉ.વ.૪૦) તા.૨૮/૫/૧૭ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે બેભાન થઈ જતા સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડૉશ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ માધુસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.